


સાહિત્યસંપર્ક

અવલોકન

ધીમા પગલે લહેરાતી ગજલનો 'પગરવ તળાવમાં'
મકરદ મુશ્ણે



‘ધીમા’ પા પગલી પાડવા વગર ઓચિંતા ચાલ્યા જનાર પોતાના નવજાત પુત્રના નહીં પડેલા પગલાંનો અષાસાર એટલે ‘પગરવ તળાવમાં’. પગ જમાવે એ પહેલાં જ પોતાના મોદ્યાબાઈના પગ તળેની જમીન ખસડી યથાના અણધાર્યાં આંચકાની વ્યથા એટલે ‘પગરવ તળાવમાં’.

‘પગરવ તળાવમાં છજી જીવંત છે મિયે;

તારા ગયાની વાતનો ક્યાં અંત છે મિયે?’

સંબંધોને નજર લાગે ત્યારે ધર અચાનક મકાન થઈ જાય છે. ભીંતો વચ્ચે ઊભા રહીને યાદોનું ખોદકામ કરતી સ્મૃતિની નજરમાં ધર હાથ લાગવાની મથામણ અહીં સ્પષ્ટ વાંચી શકાય છે.

‘તને મળી ન શક્યું કમનસીબી તારી છે,

હું તો પુરીને ગયો છું મણન્યાં ધરને.’

જીવનમાં સલાયેલા સમયના વંટોળિયા સામે ધરને સાચવવા મય્તો કવિ અશોક ચાવડા ‘બેદિલ’ બા, પિતા, ભાઈ, દીકરીના સંબંધોને ધૂટઠી ૧૦૮ ગજલ-મણકાની માણા ‘પગરવ તળાવમાં’ રૂપે આપણાને આપે છે. અશોક તેને ‘શાસયાત્રા’ કહે છે. ‘મારું સ્પષ્ટપણે માનવું છે કે વૈશિષ્ટ વેદના સાથે તમારી આંતરિક વેદના જોડી શકાય તો જ કવિતા જાણી-માણી-પ્રમાણી શકાય’ એવું કહેનાર અશોક

ચાવડાની ગજલ-નિષા આ સંગ્રહના પાનેપાને દેખાય છે. કોઈ પણ ગજલસંગ્રહમાં બધી જ ગજલો પાંચ શેરની (‘પાંચરોરી’ના અર્થમાં પણ લઈ શકાય) હોય એવું જોયું છે? એ હિસાબે પ૪૦ શેર આ ગજલસંગ્રહમાં છે.

આખાય સંગ્રહમાં કુલ મળીને ૧૨ છંદો અને ૧૧ પેટા છંદોમાં લખાયેલી ગજલોનું છંદ-વૈવિધ અશોકને મયાર્ગિત અને બીબાંદીયા છંદોમાં ગજલ લખતા અન્ય કવિઓથી જુદ્ધો પાડે છે. સંગ્રહની શરૂઆતમાં જ અનો સજાગ માંબલો વાચકને પોતાની હાજરીની યાદ અપાવીને સચેત કરે છે. માત્ર સચેત કરતો નથી, પણ અંદર લાગેલી આગથી અવગત પણ કરાવે છે.

‘આમ લાગે ન આગ અંદરથી;
કોઈ તો છે સજાગ અંદરથી.’

‘આમ’ની જગાએ ‘એમ’ શબ્દ વાપર્યો હોત તો મારા જેવાને શેરમાં ‘મલાઈ મારકે’ની અનુભૂતિ થઈ હોત હતે અશોક!

આખાય સંગ્રહમાં કવિનું ધર પ્રયેતું વળગણ ઉઘાડપણે દેખાઈ આવે છે. યુજરાતી ગજલમાં ધર વિશેના આટલા સામયા શેર કદાચ અશોક જ આખ્યા છે અને એ પણ વૈવિધ સાથે. નજર હરે એવા થોડાક શેર...

‘કોઈ રસ્તાયા કરે છે ધર માટે,
ક્યાંક જોવા મળે રસ્તાયં ધર.’

*

‘ધરની જ વાત ક્યાં હવે ‘બેદિલ’ રહી ધરે,
ધર છોડાને જતો રહ્યો ધરનો વિચાર પણ.’

*

ફરું છું એ જ કારણસર લઈ સાથે જ ધરવખરી;

કર્શું બીજું નથી છે આંખમાંનો ભેજ ધરવખરી.

અશોકની ગજલમાં સંવેદનાનું કોતરકામ પણ જોવા જેવું છે. આપણાને અંદરથી કોતરી નાખતો આ શેર જુઓ...

‘ધરમાં ધણી તકલીફ છે પણ મારું મન અશ્યા,
જાર્યા શકે ના પુત્રના ઘેલા પગારને.’

આ કવિ ધર વિશેના બે વિશેધાભાસી રદીફ લઈને પણ ગજલ લખે:

‘બારકો સાંકળ દર્દી, સામાન સધળો પેક છે,

પણ કોઈ કારણ પગ ન લીધું,

આમ એકાએક ધર છોડી જરું સ્ફેલું નથી;

લોહી જેવું નિકળી ના, પણ રહે છે ધાવ લીડા

‘કુમાર’ ૧૦૪૭ : સપ્ટેમ્બર ૨૦૧૪ | ૪૫

યાદના સધયા ઉગરે,
આમ એકાઓક ઘર છોડી જવું સહેતું નથી.'
*

તો, ક્યાંક આમ કમાલ કરે છે :
‘કરો ન આમ જોડો આ મકાનનો પણો,
નીચેથી શક્ય છે કોઈ મજૂર નીકળશે.’

આ શેરમાં ‘મજૂર’ કાઢિયા અને ‘મજૂર નીકળશે’ના શબ્દપ્રયોગથી અશોકની ગજલનું નકશીકામ ઓઈ શકાય છે. આવું નકશીકામ કરવામાં કવિને કોઈ વાર બબ્બે આંખ પણ ઓછી પડે છે :

‘બે આંખ મને કોઈ વખત ઓછી પડે છે,
ભેટ્ય વલોપાત વણી વાર હદ્યમાં.’

આંખનું એક સગપણ આંસુ સાથે પણ ખરું :
‘આંસુઓ એમ હું સખું છું,
આંખ આંખો કે આંસુદાની છે.’

આંખને ‘આંસુદાની’ કહીને અશોક ગુજરાતી ગજલમાં એક નવો શબ્દ જ પોતાને નામે કોઈન કરે છે. કોઈ વાર એક માત્રાનો ફેરફાર કરી શબ્દનું લોહિયાળ સગપણ સુધ્યાં સ્થાપી શકે. આ જુઓ...

‘લોહ ને લોહીનું હથે સગપણ,
છાથ લાંબા થયા કટાર તરફ.’

એક મત્તા લખવાનું અધરું હોય ત્યાં આ કવિ ‘ક્યાં જશે’ રહીનું આખી મત્તા ગજલ પણ આપી જાઓ.
‘આંખથી છટકી જઈ જણ ક્યાં જશે?’

છે નદી, દરિયાથી આગળ ક્યાં જશે?
ઉડતાં પંખીની પાછળ ક્યાં જશે?
મૂળ છોડીને આ પીપળ ક્યાં જશે?
સાચવેલી પીડાની પળ ક્યાં જશે?
ભીતરે જે હોય, એ સળ ક્યાં જશે?
રોજ વિસ્તરતું સમયજળ ક્યાં જશે?
ખૂબ ઉડે આ ગજલતળ ક્યાં જશે?’

જોકે પૃષ્ઠ-ઉંની ‘નથી’ ગજલમાં હવા, જગ્યા, હુઆ સાથે ‘જતાં’નો અનુનાસિક કાઢિયો અશોકને ન પરવે.
‘જે શાસમાં ભરી શકું એવી હવા નથી;
મારા જ ધરમાં ક્યાંય પણ મારી જગ્યા નથી.’

ઘરમાં પ્રવેશનારને આપી શકો વિદાય,
મનમાં પ્રવેશનાર તો પાછા જતાં નથી.’

... અને એથીય જીઝું જોવા બેસીએ તો પૃષ્ઠ-હજમાં ‘પડી’ અને ‘હશે’નો કાળનો દોષ અશોકની નજરે ચડવો છોત તો એણો નિવાર્યો જ છોત :

‘માથા ઉપરથી એક પાલવ હૂર થે ગયો,
ત્યારે ખબર પરી કે તડકો આકરો હશે.’

અશોકના શેરમાં ચિત્રાત્મકતાને કારણે દશ્ય નજર સામે ભજવાતું હોય એવું લાગે.

‘હું બરફનો એક ટુકડો, તું સળગતી મીણબતી,
જોઈએ ચલ કોણ હેલું ઓગળે? હું કે પદ્ધી તું?’

‘પીગળવું’ અને ‘ઓગળવું’ એ બનેના શાબ્દિક અર્થને અતિકમીને અશોક એકબીજાની સામે ઓગળવાની વાત કરીને નવી દિશા મેળવે છે.

અશોકની ગજલો વિશે વણી વાતો થઈ શકે, પણ હું એને લંબાવતો નથી. છેલ્લે મને ગમતા થોડા શેર મુકું છું.

‘બધા શું કામ જુઓ છે લઘરવધર કપડાં,
વીતી ગયું છે જીવન જ્યાં લઘરવધર શાસે.’

*

કોઈ વાંચે નહીં વાત એ છે અલગ,
બાળપણ જીવતો જાગતો વેદ છે.

*

મને ચારેતરફથી બીજ, ડાઢી, પાન કૂટે છે,
અચબ રીતે જ મારામાં જુઓને જે ભયી મારી.

*

સંતાપવાની લ્લાયમાં ખુલ્લો પડી ગયો,
ચાદર વધારે ફાટતી જે ખેંચતાખામાં.

શ્રી પ્રવીણ પંડ્યા અને ડૉ. રાજેશ વ્યાસ ‘મિસ્કેન’ બનેએ પ્રસ્તાવના લખીને આ કવિને વધાવ્યા છે. ગજલ એટલે શું? શેરિયત એટલે શું? ભાખાકર્મ કોને કહેવાય? જેવા પ્રશ્નોને સમજવા માંગતા સૌએ આ ગજલસંગ્રહ વાંચવો રહ્યો. અશોકના ‘પગરવ તણાવમાં’ને મારી શુભેચ્છાઓ.

(‘પગરવ તણાવમાં,’ અશોક ચાવડા, પ્રકાશક : રાન્યાં પ્રકાશન, પ.આ. ૨૦૧૨, બિ.આ. ૨૦૧૪, પૃ. ૧૩૬, ડિ. ડા. ૧૨૫/-) □